

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન વર્લ્ડ વૉર II નાં અંતની 75^{મી} વર્ષગાંઠ પર સ્મરણાંજલિ આયોજન કરશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 27, 2020) – બુધવાર, સપ્ટેમ્બર 2 નાં રોજ, સીટી ઓફ બ્રેમ્પટન વર્લ્ડ વૉર II નાં અંતની 75^{મી} વર્ષગાંઠની યાદ તાજી કરવા સ્મરણાંજલિ આયોજન કરશે. બ્રેમ્પટનના વેટેરન્સ ઓફ વૉર (નિવૃત્ત યુદ્ધવીરો) તેમજ છેવટે બલિદાન આપનારાઓનું સન્માન સીટીના [બ્રેમ્પટન રિમેમ્બર્સ](#) વેબપેજ પર કરવામાં આવશે, અને સીટી ઓફ બ્રેમ્પટનની બધી સગવડોમાં ધ્વજ અડધા (હાફ-મસ્ટ ફ્લેગ્સ) ફરકાવવામાં આવશે.

સપ્ટેમ્બર 2 નાં રોજ, [બ્રેમ્પટન રિમેમ્બર્સ](#) વેબપેજ પર મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને બ્રેમ્પટનના WWII વેટેરન્સ ઓફ વૉર, પાઈલોટ ઓફિસર બિલ બુરેલ (Bill Burrell) અને સ્વર્ગસ્થ કર્નલ એડવર્ડ કોનોવર (Colonel Edward Conover) નાં વીડિયો સંદેશાઓ તેમજ આ મહત્વની વર્ષગાંઠના ઇતિહાસ પર વધુ માહિતી પણ બતાવવામાં આવશે.

બીજા વિશ્વયુદ્ધમાં ફરજ બજાવનાર બ્રેમ્પટનિઅન્સના ફોટા અને નામો પણ સપ્ટેમ્બર 2 નાં રોજ જણાવવામાં આવશે.

વધુ માહિતી મેળવવા અને વેબસાઈટ www.brampton.ca/bramptonremembers પર સપ્ટેમ્બર 2 નાં રોજ પોતાના સંસ્મરણો અને શ્રદ્ધાંજલિઓ ઓનલાઈન આપવા સમુદાયનું સ્વાગત છે.

બેકગ્રાઉન્ડ (પશ્ચાદભૂ)

સીટી ઓફ બ્રેમ્પટન સપ્ટેમ્બર 2, 1945 નાં રોજ જાપાન દ્વારા શરણાગતિ સ્વીકારવાની સાથે બીજા વિશ્વયુદ્ધના થયેલા ઔપચારિક અંતનું સ્મરણાંજલિ આયોજન કરશે. કેનેડિયન દળોએ હોંગકોંગ સિવાય, પેસિફિક થિયેટરમાં ફરજ બજાવી ન હતી ત્યારે, ઘણાં બ્રેમ્પટનિઅન્સે યુદ્ધના યુરોપિયન થિયેટરમાં ફરજ બજાવી હતી, બ્રેમ્પટનિઅન્સની નોંધપાત્ર સંખ્યાએ પણ આપણાં એલાઈડ કન્ટ્રીસના (સાથી દેશોના) દળો સાથે પેસિફિક થિયેટરમાં ફરજ બજાવી હતી.

સપ્ટેમ્બર 2 નાં રોજ, સીટી બધાં બ્રેમ્પટનિઅન્સની સેવાને સ્મરણાંજલિ આપશે અને આપણે આજે જે સ્વતંત્રતા માણીએ છીએ તેને સાચવવા અને બચાવવા છેવટનું બલિદાન આપનારાઓને યાદ કરશે.

અવતરણો (ક્વોટ્સ):

“બીજું વિશ્વયુદ્ધ 75 વર્ષ પહેલાં પૂરું થયું હતું, અને તેનાથી બ્રેમ્પટનમાં ઘણાંના જીવન સહિત, દુનિયામાં ફેરફારો થયા હતા. હું યુદ્ધમાં નિઃસ્વાર્થપણે ફરજ બજાવનાર સૌનો આભાર માનું છું – તે લોકોની સેવાને લીધે આજે આપણે આપણી સ્વતંત્રતાનો આનંદ માણીએ છીએ. આપણાં ઇતિહાસના આ મહત્વના ભાગને સ્મરણાંજલિ આપવા આપણે રૂબરૂમાં ભેગા થઈ શકતા નથી ત્યારે, હું બીજા વિશ્વયુદ્ધના અંતને સન્માન આપવા સપ્ટેમ્બર 2 નાં રોજ [બ્રેમ્પટન રિમેમ્બર્સ](#) વેબપેજ જોવા દરેક વ્યક્તિને કહું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણે બીજા વિશ્વયુદ્ધના અંતની 75^{મી} વર્ષગાંઠે સ્મરણાંજલિ આપવા રૂબરૂમાં ભેગા થઈ શકતા નથી ત્યારે, આપણે આપણાં ઇતિહાસમાં આ મહત્વની ક્ષણ યાદ કરવાનું ચાલુ રાખીએ તે મહત્વનું છે. સીટી કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપવા એક ખાસ ઓનલાઈન સ્પેસ બનાવી છે,

જેમાં વીડિયો સંદેશાઓ, ફોટા, શોક સંદેશાઓનું પુસ્તક અને ઘણું સામેલ છે. કૃપા કરી વેટેરન્સ ઓફ વૉર અને યુદ્ધનો ભોગ બનનારાઓને સન્માન આપવા સપ્ટેમ્બર 2 નાં રોજ **બ્રેમ્પટન રિમેમ્બર્સ** વેબપેજ જોશો.”

- **ડેવિડ બારિક (David Barrick)**, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“હું વિશ્વયુદ્ધ II નાં અંતે 75^{મી} વર્ષગાંઠના ભાગરૂપે સ્મરણાંજલિ આયોજન કરવા બદલ સીટી ઓફ બ્રેમ્પટનનો આભાર માનું છું. આપણે ત્યાં બ્રેમ્પટનમાં સંઘર્ષના બંને થિયેટર્સમાં ફરજ બજાવેલા વેટેરન્સ ઓફ વૉર હોવાને લીધે, તેઓની સેવાને અને તેઓ અને તેઓના કુટુંબીજનોને તે માટે ચૂકવવી પડેલી કિમતને યાદ કરવી એ મહત્વની બાબત છે. યુદ્ધના પ્રયત્નમાં ખાસ ફાળો આપનાર આ શહેરની મહિલાઓ, ખાસ કરીને માલ્ટનમાંની એસ્કાફ્ટ ફેક્ટરીઓમાંની મહિલાઓ, કે આ સંઘર્ષ દરમિયાન યુનિફોર્મમાં સેવા આપનાર મહિલાઓની સેવાને સ્વીકારવી પણ મહત્વપૂર્ણ બાબત છે. અમે આ શહેરના એ લોકોને ખાસ સન્માન આપીએ છીએ જેઓએ આપણે આજે આનંદ માણીએ છીએ તે સ્વતંત્રતાને સાચવવા અને સંરક્ષણ કરવા છેવટે બલિદાન આપ્યું હતું તે કદાચ આપણે ભૂલીએ છીએ.”

- **હેન્રી એફ. વેશ્ચુરન (Henry F. Verschuren) CD**, પરેડ કમાન્ડર, **Maj. Wm Dwight Sharpe Royal Canadian Legion** (ડ્વાઈટ શાર્પ રોયલ કેનેડિયન લીજયન) બ્રાંચ 15

“વિશ્વયુદ્ધ II નાં અંતની 75^{મી} વર્ષગાંઠ પર, રોયલ કેનેડિયન લીજયન, શાખા 609 નાં સભ્યો, કેનેડા માટે ફરજ બજાવનાર પુરુષો અને મહિલાઓના બલિદાનને પ્રતિબિંબિત કરવા ઈચ્છે છે. આપણે અંતિમ બલિદાન આપનાર અને ક્યારેય ઘરે પાછાં ન આવનાર લોકોને યાદ કરીએ છીએ. આ એ લોકો છે જેઓ યુરોપ, આફ્રિકા, એશિયામાં રહે છે અને તેઓને ક્યારેય શોધી શકાયા ન હતા. આપણે એ વેટેરન્સ ઓફ વૉરને પણ યાદ કરીએ છીએ જેઓ ઘરે પરત આવ્યા અને હવે આપણી વચ્ચે નથી. આપણે હજુ આપણી સાથે હયાત લોકોનો પણ આભાર માનીએ છીએ, ભલે તેઓ શરીરથી પહેલાં કરતા નબળા હોય, તેઓની ભાવના આપણાં સૌ માટે પ્રેરણારૂપ બની રહેવી જોઈએ.”

- **પૉલ આર. આકરમેન (Paul R. Ackermann)**, સાજન્ટ-એટ-આર્મ્સ, રોયલ કેનેડિયન લીજયન બ્રાંચ 609

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca